

Visit of BIMSTEC Secretary General to India (August 22-25, 2022)

BIMSTEC નાં મહા સચિવની ભારતની મુલાકાત

26 ઓગસ્ટ, 2022

BIMSTEC નાં મહા સચિવ મહામહિમ શ્રીમાન તેન્ઝિન લેકફેલ દ્વારા ભારતનાં વિદેશ મંત્રાલયનાં સચિવ (પૂર્વ) શ્રી સૌરભ કુમારનાં આમંત્રણ પર 22-25 ઓગસ્ટ 2022 નાં રોજ ભારતની મુલાકાત લેવામાં આવી હતી.

2. આ મુલાકાત દરમિયાન, મુલાકાત લઈ રહેલા BIMSTEC મહા સચિવ સાથે અંતિમ શિખર સંમેલનમાં (30 માર્ચ 2022) ગ્રહણ કરવામાં આવેલા BIMSTEC ચાર્ટર અંતર્ગત BIMSTEC સંસ્થાગત માળખાનાં સંયુક્તકરણ અને વઉ વિકાસ પર વિગતવાર ચર્ચાઓ યોજવામાં આવી હતી. આંતકવાદનો સામનો કરવો, આફત વ્યવસ્થાપન મેરિટાઇમ સહકાર અને ઊર્જા સુરક્ષા સહિતનાં ભારતની આગેવાની ધરાવતા અમુક ચોક્કસ ક્ષેત્રોમાં ઝડપથી સહકાર આગળ વધારવા પર પણ ચર્ચાઓ યોજવામાં આવી હતી. ગરીબી નિવારણ, કનેક્ટિવિટી અને વ્યાપાર અને રોકાણનાં ત્રણ BIMSTEC નાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં પ્રવર્તમાન સહકારની પ્રવૃત્તિઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

3. મહા સચિવ નાયબ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર, ઊર્જા સચિવ, અને રાષ્ટ્રિય આફત વ્યવસ્થાપન પ્રાધિકરણનાં સભ્ય-સચિવને મળ્યા હતા અને વિભાગીય ક્ષેત્રોમાં BIMSTEC સહકારની સમીક્ષા કરી હતી.

4. તેઓએ "BIMSTEC ની ભાગીદારી ભૂમિકા મારફત વૃદ્ધિમાં નવો વેગ આપવો" શિર્ષક ધરાવતા વિકાસશીલ દેશો માટેની સંશોધન અને માહિતી યંત્રણાઓ (RAIS) દ્વારા યોજવામાં આવેલા જાહેર સંવાદનાં સત્રમાં પણ ભાગ લીધો હતો, જેમાં થાઇલેન્ડ, ભૂતાન અને મ્યાનમારનાં રાજદૂતો અને નવી દિલ્હી સ્થિત BIMSTEC રાજદ્વારી મિશનોનાં વરિષ્ઠ રાજદ્વારીઓએ હાજરી આપી હતી.

5. મહા સચિવ 24 ઓગસ્ટ 2022 નાં રોજ ભારતનાં વિદેશી બાબતો અને શિક્ષણ માટેનાં રાજ્ય કક્ષાનાં મંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંઘને મળ્યા હતા, આ પ્રસંગે, અંતિમ BIMSTEC શિખર સંમેલન વખતે ભારતનાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતનાં અનુસરણ તરીકે BIMSTEC સચિવાલયનાં કાર્યાત્મક બજેટ માટે 1 મિલીયન યુએસ ડોલરનો ચેક પ્રાસંગિક રીતે રાજ્ય કક્ષાનાં મંત્રી દ્વારા સોંપવામાં આવ્યો હતો.

6. BIMSTEC માં 7 સભ્ય રાષ્ટ્રોનો સમાવેશ થાય છે (બાંગ્લાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ) જેઓ બંગાળનાં અખાતનાં કાઠે સ્થિત અથવા તેનાં પર અધાર રાખતા રાષ્ટ્રો છે. શ્રીલંકા દ્વારા યોજવામાં આવેલા છેલ્લા BIMSTEC શિખર સંમેલન દરમિયાન, BIMSTEC ચાર્ટરને ગ્રહણ કર્યું હતું અને હસ્તાક્ષર કર્યા હતા જે અનન્ય આંતરરાષ્ટ્રિય કાનૂની હસ્તિ ધરાવતી સંપૂર્ણ પ્રાંતિય સંસ્થામાં તેનાં ઉત્થાન થવાને પૂર્ણ કરે છે. BIMSTEC પ્રાંતિય સહકારનાં એજન્ડાને આગળ લઇ જવા અને BIMSTEC નું બંગાળનાં અખાતનાં પ્રાંતમાં વિકાસ અને આર્થિક સહકાર માટે વાઇબ્રન્ટ પ્રાંતિય સંસ્થામાં નિર્માણ કરવા માટે ભારત BIMSTEC સભ્ય રાષ્ટ્રો સાથે કામ કરવા માટે કટિબદ્ધ છે.

નવી દિલ્હી

26 ઓગસ્ટ, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.